



આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ગુજરાત સરકાર

ઓરી અને રૂબેલા

રસીકરણ અભિયાન

એમ.આર. સૂચના કાર્ડ

પ્રિય વાલી,

એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પૂરી પાડવા માટે ઓરી - રૂબેલા (એમ.આર.)ની એક રસી શાળાઓ અને આઉટરીય સેશનમાં આપવામાં આવશે. આ એમ.આર. રસીને પછીથી નિયમિત રસીકરણમાં સામેલ કરવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ અભિયાન હેઠળ 9 મહિનાથી 15 વર્ષ સુધીનાં વયજૂથનાં બાળકોને આ રસી મૂકવામાં આવશે, તેમને એમ.આર./એમ.એમ.આર.ની રસી પહેલા આપી દેવામાં આવી હોય તો પણ.

મૂળ કારણ : ઓરી રોગની નાબુદી અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે 9 મહિનાથી 15 વર્ષ સુધીનાં બાળકોને આ રસી આપવી અત્યંત આવશ્યક છે.

ઓરી :

ઓરી એક જીવલેણ રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાય છે. બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યું થઈ શકે છે.

રૂબેલા :

રૂબેલા એક ચેપી રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાય છે. તેના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બંનેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બને તો કંજેનિટલ રૂબેલા સિન્ડ્રોમ (સી.આર.એસ.) થઈ શકે છે, જે તેના ગર્ભ અને નવજાત શીશું માટે ઘાતક સાબિત થઈ શકે છે.



યાદ રાખવા જેવી બાબતો

- આ અભિયાન દરમિયાન આ રસી 9 મહિનાથી 15 વર્ષની ઉંમર ધરાવતા તમામ બાળકોને જરૂર અપાવવી જોઇએ.
- આ રસીને તમામ શાળાઓ, આઉટરીય સેશનો, આંગણવાડી કેન્દ્રો અને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર મૂકવામાં આવશે.
- જો કોઇ બાળકને એમ.આર./ એમ.એમ.આર.ની રસી અગાઉ મૂકી દેવામાં આવી હોય તો પણ તેને આ રસી મૂકાવો.
- ઓરી - રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર થતી નથી.
- બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવશે.
- આ સામૂહિક અભિયાનમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરો.

ઓરીનો અંત આણવા તેમજ રૂબેલાના નિયંત્રણ માટે આપણો દેશ કૃત-નિશ્ચયી છે.



કૃપા કરીને 9 મહિનાથી 15 વર્ષ સુધીની વય ધરાવતા તમારા બાળકોને ઓરી - રૂબેલા રસીકરણના ઉદ્દેશ માટે અભિયાનનાં સ્થળે લઈ જાઓ.



રસીકરણની વધુ માહિતી માટે આપની આરોગ્ય કાર્યકર આશા અને આંગણવાડી વર્કર બહેનનો સંપર્ક કરો



એમ.આર. રસીકરણ અભિયાન વર્કશોપ માન. કમિશ્નરશ્રી,
WHO ના SMO, MoH તથા મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય



2018-5-15 11:05

એમ.આર. રસીકરણ અભિયાન અંગે માન. મેયરશ્રી, માન.
કમિશ્નરશ્રી ના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સ ની મિટીંગ



2018-6-4 12:33

એમ.આર. રસીકરણ અભિયાન ટાસ્ક ફોર્સ ની મિટીંગ



2018-6-4 12:38